



જુલ્લા કૃષિ હવામાન એકમ (DAMU)

ગ્રામીણ કૃષિ મૌસમ સેવા (GKMS)
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનીવર્સિટી
અમદેલી-૩૬૫૬૦૧

ફોન નં. ૦૨૭૯૨ ૨૨૭૧૨૨



(જૂનાગઢ કૃષિ યુનીવર્સિટી અને ભારત મૌસમ વિભાગ દ્વારા સંપદ્ધ)

આલાદી
કા
અમૃત મહોત્સવ

#AmritMahotsav



અહીં ક્લિક કરી કૃષિ હવામાન બુલેટીન અંગે આપના પ્રતિભાવ અવશ્ય જણાવો



અમદેલી જુલ્લાના તાલુકાઓ મુજબની હવામાન આધારિત કૃષિ સલાહ માટે ટેલીગ્રામ અથવા



વોટ્સઅપ ગુપમાં જોડાવા અહીં ક્લિક કરો

અમદેલી કૃષિ હવામાન બુલેટીન ક. ૦૧૦/૨૦૨૪

તા. ૦૨-૦૨-૨૦૨૪

પાછળા અઠવાડીયાનું અમદેલીનું હવામાન

#	હવામાન પરિબળો	27-01-24	28-01-24	29-01-24	30-01-24	31-01-24	01-02-24	02-02-24
૧	વરસાદ (મી.મી.)	0	0	0	0	0	0	0
૨	મહત્તમ તાપમાન (°સે.)	31.6	31.1	29.5	29.5	29.3	29.5	28.6
૩	લઘુત્તમ તાપમાન (°સે.)	12.3	13.8	15.9	16.8	18.1	18.2	15.9
૪	મહત્તમ બેજ સવાર (%)	72	85	84	98	100	100	96
૫	લઘુત્તમ બેજ બપોર (%)	18	26	38	42	30	28	34
૬	પવનની ગતિ (કિ.મી./કલાક)	8.5	4.4	6.0	5.6	7.7	8.2	7.7
૭	વાદળની સ્થેતિ (ઓક્ટોબર) ૮ માંથી	1	1	2	0	1	1	0

અમદેલી જુલ્લાની તા. 03/02/2024 થી 07/02/2024 ની હવામાન આગાહી:

#	હવામાન પરિબળો	03/02/2024	04/02/2024	05/02/2024	06/02/2024	07/02/2024
૧	વરસાદ (મી.મી.)	0	0	0	0	0
૨	મહત્તમ તાપમાન (°સે.)	31	32	33	32	31
૩	લઘુત્તમ તાપમાન (°સે.)	15	16	16	15	14
૪	મહત્તમ બેજ સવાર (%)	55	40	73	59	67
૫	લઘુત્તમ બેજ બપોર (%)	26	22	23	28	25
૬	પવનની ગતિ (કિ.મી./કલાક)	9	10	11	13	15
૭	પવનની દિશા (ઉત્તી)	63	68	334	328	315
૮	વાદળની સ્થેતિ (ઓક્ટોબર) ૮ માંથી	પૂર્વ ઈશાન	પૂર્વ ઈશાન	ઉત્તર વાયવ્ય	ઉત્તર વાયવ્ય	વાયવ્ય

નોંધ: આ આગાહી સમગ્ર જુલ્લાની સરેરાશ હોય છે એટલે તેને કોઈ પણ એક જગ્યા માટે લાગુ કરવી નભિ.

હવામાન અમદેલી જુલ્લામાં આગામી ૫ દિવસ દરમિયાન હવામાન મધ્યમ ઠંડુ, મધ્યમ બેજવાળું અને આંશિક વાદળછાયુ રહેવાની શક્યતા છે. મહત્તમ સારાંશ તાપમાન ૩૧-૩૩ °સે. અને લઘુત્તમ તાપમાન ૧૪-૧૬ °સે. જેટલું રહેવાની શક્યતા છે.

તા. ૦૩ અને ૦૪ ફેબ્રુઆરીના રોજ ધૂમસ આવવાની શક્યતા નહીંવત છે.

તા. ૦૫ થી ૦૭ ફેબ્રુઆરીના રોજ સવારના સમયે ઝાંકળ પડવાની તેમજ ધૂમસની આવવાની શક્યતા છે.

આગામી ૫ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.


મહત્તમ પવનની ગતિ આગામી ૫ દિવસ સામાન્ય, અંદાજીત ૮-૧૫ કિમી/કલાક સુધી ની રહેવાની શક્યતા છે. તા. ૦૩-૦૪ ફેબ્રુઆરી દરમિયાન પવનની દિશા ઉત્તર થી ઈશાન, તા. ૦૫-૦૭ ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર થી વાયવ્ય રહેવાની શક્યતા છે.

આગોત્તરાનુમાન: તા. ૦૮ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન હાલના સમયની સપેક્ષમાં ઠંડુ, મધ્યમ બેજવાળું અને આંશિક વાદળથાયું રહેવાની શક્યતા છે, આ દરમિયાન સવારના સમયે ઝાંકળ તેમજ ધૂમસની શક્યતા નહીંવત છે. મહત્તમ તાપમાન ૨૬-૨૭°C અને લઘૃતમ તાપમાન ૧૨-૧૬°C સે જેટલું રહેવાની શક્યતા છે. દરમિયાન ઠંડીના પ્રમાણમાં કમશા: વધારો થવાની શક્યતા છે, આ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.

સામાન્ય કૃષિ સલાહ	<ul style="list-style-type: none"> → ઝાડ ઉપર કેરી હોય ત્યારે ખૂલ્લી જમીનનો તડકો ન લાગે તે માટે કેઈ આચાદન કરવું અથવા મગ/ગુવાર/શાળ ઊગાડી આંબાવાડીયામાં બેજ જાળવવો અને કેરી પાક પુરો થાય બાદ તેનો લીલો પડવાશ કરી નાખવો જેથી કેરીમાં કપાસીનો (સ્પોઝી ટિશ્યુ) રોગ નિવારી શક્ય અને અન્ય કેરીમાં ફળ ઉપર સૂર્ય ગરમીથી પડતા ડાધા અટકાવી શક્ય. → વહેલું વાવેતર કરેલા ચણાની કાપણી માટેનું આયોજન કરવું. → આગામી અછવાડિયામાં ઝાંકળ પડવાની શક્યતા હોવાથી શિયાળું પાકોમાં રોગજીવાતો આવવાની શક્યતા છે, જેથી ભલામારા મુજબ યોગ્ય ફૂગનાશક/જંતુનાશકનો છંટકાખ કરવો. → શિયાળું પાકોમાં કટોકટીની અવસ્થાએ પિયત આપવું. → ઉનાળું પાકો માટે જમીનની તૈયારી અને બિયારણની પસંદગી કરવી. પ્રમાણિત અને રોગ પ્રતિકારકતા ધરાવતી જાતનું બીજ વાપરવું. → રસાયણિક ખાતરોના બદલે ગાય આધારિત અથવા જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો, અથવા જમીન ચકાસાડી કરાવ્યા બાદ જ વિવેક પૂર્વક રસાયણિક ખાતરોની ઉપયોગ કરવો. → વહેલું વાવેતર કરેલા ચણાની કાપણી માટેનું આયોજન કરવું. → દેશી ગાયોનું સિદ્ધ થયેલ આખલા થડી બીજદાન-પ્રજનન કરાવવું (અપગ્રેડેશન).
SMS	<ul style="list-style-type: none"> → દુધાળ પશુઓમાં કબજીયાતનાં નિયંત્રણ માટે નાના બચ્ચાને ૨૦-૪૦ ગ્રામ સરસીયું અઠવાડિયાનાં અંતરે પીવવડાવું.

પાક મુજબ કૃષિ સલાહ

પાક	પાક અવસ્થા	કામગીરી / જાત / જીવાત / રોગ	કૃષિ સલાહ
તલ (ઉનાળુ)	જમીનની તૈયારી અને જાતની પસંદગી	વાવેતર સમય	<ul style="list-style-type: none"> • ઉનાળું તલનું વાવેતર ફેબ્રુઆરી માસના પ્રથમ પખવાડીયામાં કરવું જ્યારે લઘૃતમ તાપમાન ૨૦ °C એને ગુરુત્તમ તાપમાન ૩૦ °C સેતે સમયે. હોય છે. ઠંડીનું પ્રમાણ પણ ઓછું હોય છે અને વરસાદ આવવાની શક્યતાઓ પણ ઓછી હોય છે.
	વાવણી	જમીનની તૈયારી	<ul style="list-style-type: none"> • ઉનાળું તલ માટે જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેક્ટાર ૧૦ ટન છાણિયું ખાતર જમીનમાં બેળવી દેવું
		જાતો	<ul style="list-style-type: none"> • ઉનાળું વાવેતર માટે ગુજરાત તલાડ અને ૫ જાત પ્રથમ પસંદ કરવી-
તરબૂચ	વાવણી	વાવેતર સમય	<ul style="list-style-type: none"> • જાન્યુઆરીના બીજા અઠવાડિયાથી મારીને માર્યાની આપખા સુધીમાં કરી શકાય.
		બિયારણનો દર અને વાવણી અંતર	<ul style="list-style-type: none"> • જમીનની પ્રત અને તેની ફળદૂપતાને ખાને રાખીને તરબૂચનું ૧ મીટર × ૧ મીટરના અંતરે વાવેતર કરવું અથવા જોડિયા હાર પદ્ધતિથી ૧ મીટર × ૦૬. મીટર × ૩ દેકે હારમાં બે છોડ વરચે ૪ મીટરના અંતરે ૧ મીટર, બે હાર વચ્ચે ૩ (૪ મીટર અંતરે) વાવણી કરવી. ટૂંકા અંતરે વાવેતર કરેલ પાકમાં ફળો કદમાં નાના રહે છે. વાવણીનું અંતર અને બીજના કદને ધ્યાનમાં લેતા ૨૫. થી ૩.૦ કિ.ગ્રા બીજ એક હેક્ટારના વાવેતર માટે. જરૂરી છે બીજને વાવણી કરતાં પહેલાં ફૂગનાશક દ્વારાની બીજ માવજત આપવી હાઈબ્રિડ જાતનું વાવેતર કરવું.
		ઠંડી થી રક્ષણ	<ul style="list-style-type: none"> • નવા ઉગેલા છોડને ઠંડી થી રક્ષણ આપવા જરૂર જરૂરાય તો ગ્રો કવન્ઝો ઉપયોગ કરવો.
મગ (ઉનાળુ)	જમીનની તૈયારી અને જાતની પસંદગી	જમીનની તૈયારી	<ul style="list-style-type: none"> • ઉનાળું મગનું વાવેતર ૧૫ ફેબ્રુઆરી થી ૧૫ માર્ચ સુધીના સમયગાળા દરમ્યાન કરવાથી વધુ ઉત્પાદન મળે છે.

આજરો (ઉનાળુ)	જમીનની તૈયારી અને જાતની પસંદગી	વાવણીનો સમય	<ul style="list-style-type: none"> હેબ્બુઆરીના પહેલા કે બીજા અઠવાડીયા દરમિયાન કરી દેવું જોઈએ.
		જમીનની તૈયારી	<ul style="list-style-type: none"> જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૦ ટન સારી રીતે કોહવાળોલા છાણિયા ખાતરને પ્રાથમિક પેડ કરતા પહેલા નાખવું ત્યાર પછી હળ કે કરબ વડે સારી રીતે જમીનમાં મેળવી દેવું.
		જાતની પસંદગી	<ul style="list-style-type: none"> (પરેક-જીએચબી) પરટ-ગુજરાત હાઇબ્રિડ બાજરી (૧) (પાપેચ-જીએચબી) પાપ-ગુજરાત હાઇબ્રિડ બાજરી (૨) (પાપ-જીએચબી) પાપ-ગુજરાત હાઇબ્રિડ બાજરી (૩)
આંખો	લખોટી જેટલા કદના ફળ	પિયત	<ul style="list-style-type: none"> આંખામાં વટાણા જેવી ડેરી થાય ત્યારે ૧૫ દિવસના અંતરે ખામણાં ભરી પિયત આપવાથી ડેરીની સંખ્યામાં વધારો થાય છે ડેરીના ફળની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે અને ડેરીઓ ખરી પડતી અટકે છે.
		આચાદન/આવરણ/મલ્લોંગ/લીલો પડવાશ	<ul style="list-style-type: none"> આડ ઉપર ડેરી હોય ત્યારે ખૂલ્લી જમીનનો તહકો ન લાગે તે માટે કંઈ આચાદન કરવું અથવા મગશાણ ઉગાડી આંખાવાદીયામાં બેજ જાળવવો/ગુવાર/ અને ડેરી પાક પુરો થાય બાદ તેનો લીલો પડવાશ કરી નાખ્યો જેથી ડેરીમાં કપાસીનો સ્પોન્જુ (ટિશ્યુ રોગ નિવારી શકાય અને અન્ય ડેરીમાં ફળ ઉપર સૂર્ય ગરમીથી પડતા દાદ્યા અટકાવી શકાય).
લીબુ	ફળ અવસ્થા	બળિયા ટપકા	 <ul style="list-style-type: none"> બળિયા ટપકા ના નિયંત્રણ માટે નવેમ્બર-ડિસેમ્બર, હેબ્બુઆરી-માર્ચ, જુન અને જુલાઈ-ઓગસ્ટ માં એમ કુલ ચાર વખત ૧૦:૦૫:૧૦૦ ના પ્રમાણ વાળું બૂડોડો મિશ્રણ અથવા તાંબા યુક્ત દવાનો છંટકાવ કરવો.
બોર	પિયત	ફળ અવસ્થા	<ul style="list-style-type: none"> બોરીને વર્ષમાં ૩૦ દિવસના ગાળે કુલ ચાર પિયત આપવા, છેલ્લુ પિયત જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં આપવું.
મગફળી (ઉનાળુ)	જમીનની તૈયારી અને જાતની પસંદગી	જમીનની તૈયારી	<ul style="list-style-type: none"> ઉનાળુ મગફળી રૂ થી ૪૫ સે. ઉષ્ણતામાનમાં સારી રીતે ઊરી શેડ છે જેથી જાન્યુઆરી માસમાં ઠંડી ઓછી થાય કે તરત જ મગફળીનું વાવેતર કરી દેવું જોઈએ. ઉનાળુ મગફળીનું વાવેતર કરવા માટે ઊરી અને વહેલી પાકતી જી.જી.-૨, જી.જી.-૫, જી.જી.-૬, ટીએજી-૨૪, ટી.જી.-૨૬, ટીપીજી-૪૧, ટીજી-૩૭એ, આઈસીજીએસ-૩૭ અને આઈસીજીએસ-૪૪ માંથી કોઈપણ એક જાતની પસંદગી કરવી.
		વાવણી અંતર અને બિયારણનો દર	<ul style="list-style-type: none"> વાવેતર અંતર: ૩૦ x ૧૦ સેમી બિયારણનો દર: ૧૨૦ કિગ્રા/હેક્ટર
		બીજ માવજત	<ul style="list-style-type: none"> રસાયાણિક: જમીન અને બીજ અન્ય રોગો જેવા કે બીજાનો સરો તથા ઉગસુકનો રોગ સામે રક્ષણ મેળવવા માટે ટેચ્યુનાઝોલ અથવા થાયરમ દવા ૩ ગ્રામ/કિલો બીજ પ્રમાણે પટ આપી વાવણી કરવી. જૈવિક: ફૂગ નિયંત્રણ માટે ટ્રાયકોર્ડમાં ૧૦ ગ્રામ પ્રતિ કિલોગ્રામ બિયારણ સાથે રાઈઝોબિયમ અને ફોસ્ફેટ કલ્યાસનો પટ આપી વાવેતર કરવું.
		ખાતર	<ul style="list-style-type: none"> જમીનનો નમૂનો જમીન ચકાસણી પ્રયોગશાળામાં ચકાસણી કરાવી ભલામણ મુજબ ખાતરો આપવા . હેક્ટર દીઠ ૮ થી ૧૦ ટન સાથ છાણીયું ખાતર અથવા ૧ ટન દિવેલીનો ખોળ આચા પછી રસાયાણિક ખાતર પાયામાં એક જ વખત આપવું. જો જમીનમાં ગંધક તત્વની ઉણાપ જણાય તો હેક્ટર દીઠ ૨૦ કિ.ગંધક આપવો .ગ્રા. ઉનાળુ મગફળીમાં હેક્ટર દીઠ ૧૫ કિ.ગ્રા ફોસ્ફોરસ ચાસમાં ઓરીને આપવો.નાઈટ્રોજન અને ૫૦ કિ.ગ્રા.
ચણા	પોપટા અને દાણા ભરવા	લીલી ઈયન	 <ul style="list-style-type: none"> ચણાનાં પાકમાં લીલી ઈયના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે એચર. વી.પી.એન.૨૧૦૮ પી / .બી.ઓ. (૧૦ લીટર પાણીમાં/૫ મીલી) મીલીઅને કલોરાન્ટ્રાનીલીપોલ ૧૮.૫ એસ.સી રી) . ચણાનાં પાકમાં લીલી ઈયના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે એચર. વી.પી.એન.૨૧૦૮ પી / .બી.ઓ. (૧૦ લીટર પાણીમાં/૫ મીલી) મીલીઅને કલોરાન્ટ્રાનીલીપોલ ૧૮.૫ એસ.સી રી) . ચણાનાં પાકમાં લીલી ઈયના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે એચર. વી.પી.એન.૨૧૦૮ પી / .બી.ઓ. (૧૦ લીટર પાણીમાં/૫ મીલી) મીલીઅને કલોરાન્ટ્રાનીલીપોલ ૧૮.૫ એસ.સી રી) . ચણાનાં પાકમાં લીલી ઈયના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે એચર. વી.પી.એન.૨૧૦૮ પી / .બી.ઓ. (૧૦ લીટર પાણીમાં/૫ મીલી) મીલીઅને કલોરાન્ટ્રાનીલીપોલ ૧૮.૫ એસ.સી રી) . ચણાનાં પાકમાં લીલી ઈયના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે એચર. વી.પી.એન.૨૧૦૮ પી / .બી.ઓ. (૧૦ લીટર પાણીમાં/૫ મીલી) મીલીઅને કલોરાન્ટ્રાનીલીપોલ ૧૮.૫ એસ.સી રી) .
		સુકારો અને મૂળનો કોહવારો	 <ul style="list-style-type: none"> કાર્બન્ડાજીમ ૫૦ વે ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણી પ્રમાણે દ્વારાણ બનાવી. પા. રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે
		સંટ વાઈરસ	 <ul style="list-style-type: none"> રોગ મોલોમશી મારફતે ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષ્કપ્રકારની ક્રિટનાશક જેવી કે મિથાઇલ અથવા ડાયમીથોએટ ૧૦ વી.ઓડીમેટોન ૧૨ મિ-૧૦ લિટર પાણીમાં મેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. લિ.મિ
કુંગળી	કંદનો વિકાસ	શેંગ વળી જવી અને જાંબલી ધાબાનો રોગ	 <ul style="list-style-type: none"> કુંગળીમાં જાંબલી ધાબા, કોલેટોન્ટાયકમ અને ફ્લૂજેશીયમ ફૂગનો રોગ લાગે નહિ તે માટે પ્રોપીકોનાઝોલ, મેનોઝેબ ૪૦ ગ્રામ અને કાર્બન્ડાજીમ ૧૫ ગ્રામ ૧ પદ્ધતમાં વારાફરતી કોઈપણ એક દવા નાખીને ૧૫ દિવસના અંતરે ૩ છંટકાવ કરવા.

લસણ	વૃદ્ધિ	પિયત	<ul style="list-style-type: none"> સફેદ કાળું હુગળીના વાયેતર સમયે કાર્બન્ડાજીમ દવા ર થી તુ ગ્રામ પ્રતિ ડિલો મુજબ પટ આપીને પછી વાયેતર કરવું. શિયાળું હુગળીનો રોમ ગાઢી ક્યારા બનાવી તૈયાર કરવો. જરૂરિયાત મુજબ પિયત આપવું લસણમાં પાનનો પીજિયો રોગ આવે નહિ તે માટે વધુ પડતું પિયત આપવું.
શેંગલટામેરા / ફળનો વિકાસ	ફળનો વિકાસ	સફેદ માખ્યો	<ul style="list-style-type: none"> શેંગલા અને ટામેરીમાં સફેદ માખ્યોની નિયંત્રણ માટે બીબોળીનું તેલ પઠ મિશ્ર અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા એકનું દ્રાવણ ૫૦૦ મીલી અને ડાયફેથાયૂરોન ૫૦ ટકા વે ૧૬ ગ્રામ અથવા ટ્રાયાજોફોસ ૪૦ .પા. .ટસી રૂપ મિલી. દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો .
કુંઘ અને ફળ કોરી ખાનાર ઈચ્છા	કુંઘ અને ફળ કોરી ખાનાર ઈચ્છા	ફળ અને કોરીની પાણી	<ul style="list-style-type: none"> કુંઘ અને ફળ કોરીનો ઉપદ્રવ હોય તો નુકશાન પામેલ કુંઘ અને ફળ તોડીને જમીનમાં દાંઠી દેવા અને કલોરાન્ટાનીલીપોલ ૧૮.૫ એસ.સી દવા ૩ મિલી અથવા ડિડીવીપી ૭૬ ટસી ૫ મિલી ૧૦ (શીનાક્ષીપાયર) .લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો
પાન કથીશી	પાન કથીશી	પાન કથીશી	<ul style="list-style-type: none"> શેંગલામાં જો પાનકથીશીનો ઉપદ્રવ હોય તો ઈથીઓન ૫૦ ટકા ટસી ૧૫ મિલી અથવા પ્રોપરગાઈટ ૫૭ ઇ.૧૫ મિલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો .સી.
લધુપણી	લધુપણી	લધુપણી	<ul style="list-style-type: none"> રોગ તહતીયાંથી ફેલાતો હોવાથી રોપણી પછી ૧૦ થી ૧૫ દિવસે કાંબોફ્લૂરાન ૩ જી ૧ કિ .એ/તત્વ.સ.ગ્રા. પ્રમાણે છોડની ફરતે શેંગ પદ્ધતિથી આપવું અને ૧૦ થી ૧૨ દિવસના અંતરે ડાયમીયોએટ ૩૦ ટસી ૧૦ મિ અથવા ચાયોમેથોક્ઝામ ૪૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને વારાકરતી જરૂર .લિ. પ્રમાણે છંટકાવ કરવો
ધાઉ	મુકૂટ તંતુ મૂળ અવસ્થા/ કૂટ અવસ્થા	સુકારો અને ગેસુ	 <ul style="list-style-type: none"> રોગની શરૂઆતમાં મેસોઝેબ ૧૫ વેપા ૨૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
ધાળા	કૂલ /વૃદ્ધિ અવસ્થા	નીદામણ અને આંતરખેડ	ઉધઈ <ul style="list-style-type: none"> ધાઉના ઊભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ શરૂ થતો જણાય તો તુરત જ એક હેક્ટર પાકના વિસ્તાર માટે ફ્લોનિલ ૫ એસ.સી ૧.૫ લિટર ૧૦૦ કિ.દ લિટર અથવા કલોરાપાયરીફોસ ૨૦ ટસી ૧.ગારેતી . સાથે બશબર લેળવી માવજન આપેલ રેતી ધાઉના ઊભા પાકમાં પૂંખવી અને ત્વારબાદ પાકને હળવું પિયત આપવું અથવા આ ડીટનાશકનો જથ્થો પાણીના ટાણીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે શીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસંગે રેતો આપવી
જીંબ	કૂલ વૃદ્ધિ / અવસ્થા	પિયત	<ul style="list-style-type: none"> જીંબના પાકમાં પ્રથમ પિયત વાવણી બાદ તૂરત જ આપવું . જીંબનો ઉગાવો ૧૧ થી ૧૨ દિવસે થતો હોવાથી સારા ઉગાવા માટે બીજુ પિયત જમીનની પ્રતિ પ્રમાણે ૮ થી ૧૦ દિવસે સમયસર આપવું. નીજુ પિયત નીદામણ કર્યા બાદ ૩૦ દિવસે આપવું અને ચોંચું પિયત પઠ દિવસે આપવું.
		નીદામણ અને આંતરખેડ	<ul style="list-style-type: none"> જીંબના પાકમાં જીંબાણો નીદામણ મોટાબાગે જોવા મળે છે જીંબાણા નિયંત્રણ માટે વાવણી બાદ ૨૫ થી .૩૦ દિવસે અને ૫૦ થી ૬૦ દિવસે હાથથી નીદામણ કરી નીદાશમુક્ત રાખી શકાશે
		શ્રીસ	<ul style="list-style-type: none"> જીંબમાં શ્રીસના જૈવિક નિયંત્રણ માટે બ્યુવેરીયા બેસીયાના ૧૫ વેપા ૬૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં .મિશ્ર કરી જીંબ દેખાયો ત્યારે અને તેના ૧૦ દિવસ બાદ એમ બે છંટકાવ કરવો
		ભૂકીછારો	<ul style="list-style-type: none"> ભૂકીછારા રોગના નિયંત્રણ માટે વહેલી સવારે ૩૦૦ મૈન્ઝનો ગંધક પાવડર હેક્ટરે ૧૫ થી ૨૦ શીઅથવા.ગ્રા. પ્રોપીકોનાજોલ રૂપ ૧૫૩૦ .લી. લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
		કાળીયોચરણી /	<ul style="list-style-type: none"> જીંબમાં ચરમી રોગના નિયંત્રણ માટે પાક ૩૦ દિવસનો થાય ત્યારે મેસોઝેબ ૭૫% વેટેબલ પાવડર રૂપ ગ્રામ અથવા એજોક્સિસ્ટ્રોબીન ૨૩ એસ.સી ૧૦ મિલ.પા.અથવા પ્રોપીનેબ ૭૦ વે .લી. ગ્રામ અથવા પ્રોપીકોનાજોલ રૂપ ૧૫૩૦ .લી. લીટર પાણીમાં ભેળવી જરૂરાત મુજબ છંટકાવ કરવો.
પશુપાલન			<p>પશુપાલન</p>  <ul style="list-style-type: none"> મકાઈની ઘાસચારા માટે વાવણી કરવી. દેશી ગાયોનું સિદ્ધ થેલ આમલા થડી બીજદાન-પ્રજનન કરાવવું (અપગ્રેડેશન) પ્રજીવથી થતો રોગોની ચકાસણી કરાવવી. ઇતરડીના નિયંત્રણ માટે ટેલ્ટામેશીન અથવા એમીટ્રાઝ ૨ મી.લી. ૧ લીટર પાણીમાં નાપીને છાંટવી. પશુને રૂપ ૮ થી ૧૫ ગ્રા. સૂકો અને ૧૫ થી ૨૦ ગ્રા. લીલો ચારો આપવો. દુધાળા પશુઓને પ્રતિ લીટર દુધની ઊપર મુજબ નિયમિત ૧ કી.ગ્રા. ફીડ ૫૦ ગ્રામ ખનીજ તત્વોનું મિશ્રાશ આપવું.

વિષય નિષ્ઠાંત
કૃષિ હવામનશાસ્ત્ર



District Agrometeorological Unit (DAMU)

Gramin Krishi Mausam Seva (GKMS)

Krishi Vigyan Kendra

Junagadh Agricultural University

Amreli-365601

Phone: 02792-227122



Issued jointly by Junagadh Agricultural University and India Meteorological Department



Join our Telegram channel and block wise WhatsApp groups



Amreli District Agromet Advisory Service bulletin. No. 010(2024)

Date: 02-02-2024

Significant weather of past week, Amreli

#	Parameter	27-01-24	28-01-24	29-01-24	30-01-24	31-01-24	01-02-24	02-02-24
1	Rainfall (mm)	0	0	0	0	0	0	0
2	Max.Temp.(°C)	31.6	31.1	29.5	29.5	29.3	29.5	28.6
3	Min.Temp.(°C)	12.3	13.8	15.9	16.8	18.1	15.9	15.9
4	RH-I (%)	72	85	84	98	100	100	96
5	RH-II (%)	18	26	38	42	30	28	34
6	Wind Speed (kmph)	8.5	4.4	6.0	5.6	7.7	8.2	7.7
7	Total CC (octa) out of 8	1	1	2	0	1	1	0

Weather Forecast from 03/02/2024 to 07/02/2024

#	Parameter	03/02/2024	04/02/2024	05/02/2024	06/02/2024	07/02/2024
1	Rainfall (mm)	0	0	0	0	0
2	Max.Temp.(°C)	31	32	33	32	31
3	Min.Temp.(°C)	15	16	16	15	14
4	RH-I (%)	55	40	73	59	67
5	RH-II (%)	26	22	23	28	25
6	Wind Speed (kmph)	9	10	11	13	15
7	Wind Direction(deg.)	63	68	334	328	315
		ENE	ENE	NNW	NNW	NW
8	Total CC (octa) out of 8	3	3	2	2	1

Note: Above forecast is the average situation of whole district

Agro-Advisory

Weather Summary

- The weather in Amreli District likely moderate cool, moderate humid and partly cloudy in next 5 days.

- The maximum temperature is likely to be 31-33 °C. The minimum temperature is likely to be 14-16° C in next five days.
- No probability of fog and des formation from 03-04 February, The scattered fog and dew formation likely from 05 to 07 February. no probability of rainfall on next five days.**
- Wind direction likely from ENE from Day-1 to Day-2, and from N-W from Day-3-5, Wind speed 9-15 km/h.
- Extended Range weather forecast:** The weather of Saurashtra region likely relatively cool, moderate humid and partly cloudy from 08-12 February 2024. No probability of rainfall over the region. Maximum temperature likely 26-32 °C and minimum temperature likely 12-16 °C in subsequent week.

General Advisory

- When there is Fruit on the tree, cover the open ground or sowing green gram/cluster bean / sun-hemp to maintain moisture in the soil of mango orchard and use it as in-situ green manuring after completion of mango crop to prevent sponge tissue disease. And in other mangoes, the stains from the sun heat on the fruit can be prevented.
- Do harvesting of early sown chickpea.
- Apply spray of recommended pesticides in standing rabi crops due to fog and dew forecasted in subsequent week.
- Apply irrigation at critical stages of summer crops.
- Prepare the field and select the seed material for summer crops
- Use organic and cow-based manure instead of chemical fertilizers, or use chemical fertilizers based on soil testing report.
- Do harvesting of early sown chickpea.

SMS Advisory:

- To control constipation, give 20-40 grams of mustard oil to the calf at weekly intervals.

Crops	Crop Stage	Practices	Advisory
Sesame (Summer)	Field Preparation and Variety Selection	Sowing	<ul style="list-style-type: none"> Sowing to be done in 1st fortnight of February, when minimum temperature is greater than 20 °C and Maximum temperature is greater than 30 °C.
		Land Preparation	<ul style="list-style-type: none"> Apply FYM @ 10 t/ha
		Varieties	<ul style="list-style-type: none"> GT-3 and GT-5
Watermelon	Sowing	Sowing time	<ul style="list-style-type: none"> 2nd Week of January to Last week of March
		Spacing and Seed rate	<ul style="list-style-type: none"> Planting of watermelon at a distance of 2 m × 1 m depending on the soil texture and its fertility or by twin-row method at a distance of 1 m × 0.6 m × 3.4 m (1 m

			between two plants in each row, 3.4 m between two rows) to sow. Fruits remain small size in short distance planted crop. Considering the sowing distance and seed size, 2.5 to 3.0 kg Seeds are required for sowing one hectare. Seed treatment with fungicide before sowing Planting of hybrid.
		Grow Covers	<ul style="list-style-type: none"> • Use grow covers if necessary to prevent crop from chilling injury.
Green gram	Field Preparation and Variety Selection	Sowing time	<ul style="list-style-type: none"> • February 15th to March 15th
Pearl Millet	Field Preparation and Variety Selection	Sowing time	<ul style="list-style-type: none"> • 1st or 2nd Week of February
		Land preparation	<ul style="list-style-type: none"> • While preparing the land, apply 10 tonnes of well-decomposed FYM per hectare before primary ploughing, then mix it well with a plough or hoe.
		Selection of varieties	<ul style="list-style-type: none"> • (1) Gujarat Hybrid Bajri-526 (GHB-526) • (2) Gujarat Hybrid Millet-558 (GHB-558) • (3) Gujarat Hybrid Millet-538 (GHB-538)
Mango	Pea sized fruit	Irrigation	<ul style="list-style-type: none"> • Apply Irrigation at 15 days of interval when the fruit is about size of pea.
		Green manuring/ Spongy tissue /Mulching	<ul style="list-style-type: none"> • When there is Fruit on the tree, cover the open ground or sowing Green gram/cluster bean / sunn-hemp to maintain moisture in the soil of mango orchard and use it as in-situ green manuring after completion of mango crop to prevent sponge tissue disease. And in other mangoes, the stains from the sun heat on the fruit can be prevented.
Lime	Fruiting	Citrus Canker 	<ul style="list-style-type: none"> • Apply four spray of Bordeaux mixture or copper based fungicide in November, February, June and July for the control of the citrus canker.
Ber	Fruiting	Irrigation	<ul style="list-style-type: none"> • Apply 4 irrigation in ber from October to February, Apply last irrigation in 2nd Week of January.
Groundnut Summer	Pre-Sowing	Land Preparation and Variety Selection	<ul style="list-style-type: none"> • Summer Groundnut Grow well in 23 to 25 °C temperatures so the cold is a decreasing in January, Groundnut should be sown. • Varieties: GG-2, GG-5, GG-6, TAG-24, TG-26, TPG-41, TG-37A, ICGS-37 choose any one early maturing variety from these.
		Spacing and Seed rate	<ul style="list-style-type: none"> • Spacing: 30 X 10 cm • Seed rate: 120 to 130 kg/ha
		Seed treatment	<ul style="list-style-type: none"> • Chemical: Tebuconazole or Thiram @ 3g/kg seed • Bio fungicide: Trichoderma @ 10 g/kg seed with Rhizobium and Phosphate culture

	Fertilizer	<ul style="list-style-type: none"> • Apply after the soil testing. • Apply 8 to 10 tonne FYM/ha + Castor cake @ 1 ton/ha • Apply Sulphur @ 20 kg/ha if there is deficiency in soil • Recommended fertilizer dose: 25-50-0 NPK kg/ha
Chickpea	Pod development and grain filling	<p>Pod borer</p> <ul style="list-style-type: none"> • Apply alternate spray of HaNPV 2×10^9 POBs/ml (5 ml/10 lit. water) and chlorantraniliprole 18.5 SC 0.004 % (2 ml/10 lit. water) for effective and economic control of pod borer (<i>Helicoverpa armigera</i>) in chickpea crop. First spray to be started at 50% flowering and second at 15 days after first spray
		<p>Wilt and root rot</p> <ul style="list-style-type: none"> • The severity of the disease can be reduced by dissolve carbendazim 50 WP @ 10 gm in 10 liters of water and applying it in the soil around the infected plants
		<p>Stunt virus</p> <ul style="list-style-type: none"> • As the disease is spread through aphid, systemic insecticide like Methyl-O-dimeton @12 ml Or dimethoate @ 10 ml Mix in 10 liters of water and spray as required
Onion	Bulb formation	<ul style="list-style-type: none"> • Seed should be sown on raised seedbed for seedling purpose. • Carry out transplanting of onion, if seedling is ready. • For the control of purple blotch blight and fusarium wilt disease in onion make 3 alternate sprays of Mancozeb 25 gm and Carbendazim 10 gm in 10 litres of water at 10 days interval.
Mustard	Pod development	<p>Sawfly</p> <ul style="list-style-type: none"> • Kill the caterpillars by hand by dipping them in kerosene water at the beginning of the infestation. Apply a spray of Neem oil 50 ml Or neem based pesticide 20 ml (1 EC) to 40 ml (0.15 EC) in 10 litres of water. However, if the infestation is not controlled then apply Spray of dimethoate 30 EC @ 10 ml or quinalphos 25 EC @ 20 ml in 10 litres of water.
		<p>White Rust</p> <ul style="list-style-type: none"> • at the beginning of the disease Apply a spray of Mancozeb 75 WP 27 gm in 10 litres of water twice at 15 days of interval.
		<p>Powdery Mildew</p> <ul style="list-style-type: none"> • Apply a spray of wettable Sulfur 80 WP @ 25 g or Dinocap 48 EC @ 5 ml or hexaconazole 5 EC @ 5 ml in 10 litres of water. First spray at the initiation of the disease and one or two sprays depending on the severity of the disease.
Garlic	Vegetative stage	<p>Fertilizer</p> <ul style="list-style-type: none"> • Apply 25 kg Nitrogen fertilizer at one month after sowing as supplementary dose.
		<p>Thrips</p> <ul style="list-style-type: none"> • Apply schedule spraying of Beauveria bassiana 1.15 WP (Min. 2×10^6 cfu/g), first spray at initiation of pest infestation 0.0035 % (30 g/10 l of water). Subsequent second 0.007 % (60 g/10 l of water) and third 0.009 % (80 g/10 l of water) spray at 10 days interval for effective and economical management of thrips, <i>Thrips tabaci</i> in garlic.

Brinjal & Tomato	Fruit Development	Sucking pest	<ul style="list-style-type: none"> For minimize population of whitefly, Spray 500 ml of 5 % neem seed extract or neem oil 50 ml or Difenthiuron 50 WP @ 16 gm / 10 lit of water.
	Fruit Development	Shoot & Fruit borer	<ul style="list-style-type: none"> In brinjal and tomato crops, monitoring of borers by using pheromone traps 4-6 per acre is advised. For control of shoot and fruit borer in brinjal and tomato crops, infested fruits and shoots should be collected and buried into the soil. If insect population is above ETL then spraying of chlorantraniliprole 18.5 % SC 3.0 ml or DDVP @ 7 ml/10 litre of water is advised.
		Mites	<ul style="list-style-type: none"> If infestation of mite is observed in brinjal, then spraying of Ethion 50 EC 15 ml or Propargite 57 % EC @ 10 ml/ 10 litre of water.
		Little leaf	<ul style="list-style-type: none"> Apply Carbofuran 3g @ 1 kg a.i./ha around the plant by ring method due to the disease is transmitted through jassids. Also, apply a spray of dimethoate 30 EC @ 10 ml or thiamethoxam 25 WG @ 4 gm at 10 to 12 days of intervals.
Wheat	Crown Root initiation and tillering	Leaf blight and rust	<ul style="list-style-type: none"> To control leaf blight and rust in wheat, at the beginning of the disease apply a spray of Mancozeb 75 WP 27 gm in 10 litres of water twice at 15 days of interval.
		Termite	<ul style="list-style-type: none"> If a termite infestation is observed in the standing crop of wheat, immediately apply Fipronil 5 SC @ 1.6 litres or Chlorpyrifos 20 EC @ 1.5 litres with 100 kg of sand or soil per hectare. then lightly irrigate the crop.
Corriender	Flowering and Vegetative	Weeding and Interculturing	<ul style="list-style-type: none"> Two hand weeding and 2 to 3 interculturing operations are recommended, Or Apply pendimethaline 1.0 kg a.i or fluchloralin 0.9 kg a.i/ha as a pre-emergence if there is shortage of labour.
Cumin	Flowering and Vegetative	Irrigation	<ul style="list-style-type: none"> Apply light irrigation after sowing. Apply second irrigation 8 to 10 days after sowing since, germination of the crop at 11 to 12 days.
		Weeding and Interculturing	<ul style="list-style-type: none"> Keep crop weed free by doing weeding at 25 to 30 and 50 to 60 days after sowing. If there is sowing of the crop is done by broadcasting method then apply Pendimethalin @ 1.0 kg a.i. in 500 to 600 liters of water as a pre-emergence for the weed control.
		Thrips	<ul style="list-style-type: none"> Apply two sprays of Beauveria bassiana 1.15 WP (Min. 2x10⁶ cfu/g) 0.007 % (60 g/10 l of water), first at initiation of pest infestation and second at ten days interval for effective, economical and eco-friendly management of thrips
		Powdery Mildew	<ul style="list-style-type: none"> Apply spray of Propiconazole @ 10 ml/10 liter in water or Hexaconazole or Supher @ 15-20 kg/ha for control of powdery mildew.
		Fusarium Wilt	<ul style="list-style-type: none"> Apply spray of Mancozeb 75 WP @25 g liter or Azoxystrobin 23 SC @ 10 ml or Propineb 70 WP @ 15 g

or Propiconazole 25 EC @ 10 ml in 10 liter of water for the control of fusarium wilt.

Livestock



- Sowing maize for the fodder purpose.
 - Spray Deltamethrin or Amitraz 2 ml/litre of water for the control of tick. Carry out Brucella and other infectious& reproductive diseases evaluation. Spray phenyl in the animal shed to avoid flys and mosquitoes.
 - For milch animals, regularly follow schedule of 1 kg feed + 50 g mineral mixture per 2 liters of milk yield. Feed animals with a mixture of green grass + hay + minerals + dry feed.
-

**Subject Matter Specialist
Agrometeorology**